https://archive.org/details/bk0752/page/n0/mode/1up

2010 Before -Poem -Ukel Mangta Samajik Prashno -by Akhairam Valji -Kolkata (752)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

શ્રી ઉમિયાય નમઃ

"ઉકેલ માગતા સામાજીક પ્રશ્નો"

સુનો સુનો યુવાન બંધુઓ, પારીદારનાં સંતાનો,
જ્ઞાતિગૌરવ ગાથા રચવા, શું કરવું વિચાર કરો -- હો સુનો સુનો
...ાજના વણ-ઉકેલ્યા પ્રશ્નો, મનને મુંઝવણમાં મુકતા,
એ સવાલના જવાબ શોધવા, સાથ સૌ તૈયાર રહો -- હો સુનો સુનો
ભલેભલા ભોળાવી બંધુ, શુભ કાર્યોમાં ઝંપલાવો,
સમાજના ઉન્નત કાર્યોમાં, તન-મન-ધનથી સાથ દીયો - હો સુનો
કન્યાની કેળવણી ક્ષેત્રે, આંખ મીંચોણાં વરતાયે,
પુત્ર-પુત્રીના અભ્યાસ ક્ષેત્રે, ભેદ ભાવ આ શા માટે? (૨) - એ સવાલ
શિક્ષિત બહેનો ઘુંઘટ ઓઢે, નીજ પ્રતિભાને ગુંગળાવે,
આસાચાર આ રૂઢિચુસ્તતા, માન્ય કરાતી શા માટે? (૨) - એ સવાલ
છૂટાછેડા સહેજે થઈ જાતા, ઘર ખૂણે એ ઘર ભાંગે,
બે ગલઢેરા સ્વાર્થ પોષવા, હીણા કર્મ કરે શા માટે? (૨) - એ સવાલ
કન્યાનાં વેચાણ થતાં જેમ ગાય વેચાય કસાઈ ઘરે,
દલાલનો એ ધીકતો ધંધો, હજુ સાંખવો શા માટે? (૨) - એ સવાલ
સંપ્રદાય એક સતપંથ ચાલે, હિન્દુ સંસ્કૃતિથી અલગ જણાયે,
સમાજનો એ ઠરાવ અઢારનું, ઉલ્લંઘન કરતા શા માટે? (૨) - એ સવાલ
આગેવાન સતપંથી જો એવા, નીજ સ્વજનના મૃત્યુવેળા,
દફન ક્રિયા સિદ્ધાંતને ભૂલી, અગ્નીદાહ કરે શા માટે? (૨) - એ સવાલ
વિત્ત સ્વાર્થી કોઈ માનવ ભૂલ્યા, સમજે પણ અણસમજુ જનતા,
જાગ્યા ત્યાંથી સવાર ગણો, એ સૂત્ર વિસરતા શા માટે? (૨) - એ સવાલ
ધર્મ સનાતન પારીદારનો, ઓધવરામજી સમજાવે,
ધર્મ વિધર્મી લાગે તેવો, સંપ્રદાય એ શા માટે? (૨) - એ સવાલ
નારાયણ રામજી બહુ ઝઝુમ્યા, ધર્મ ભુલી જ્ઞાતિ માટે
કંઈક વર્ષો વહી ગયાં પણ, આશ અધુરી શા માટે? (૨) - એ સવાલ
જટીલ પ્રશ્નોના ઉત્તર શોધવા, દોસ્તો મળજો એક સાથે,
નવચેતનીયાની દાઝ હૃદયની, ઉકેલવી ના શા માટે? (૨)
- એ સવાલનો જવાબ શોધવા ---

— — — — — — —

રચયિતા:
શ્રી અખેરામ વાલજી પટેલ
કલકત્તા.

realpatidar.com

https://archive.org/details/bk0752/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk0752/page/n2/mode/1up

(6)

realpatidar.com

શ્રી ઉમિયાય નમઃ

"ઉકેલ માગતા સામાજીક પ્રશ્નો"

સુણો સુણો યુવાન બંધુઓ, પાટીદારનાં સંતાનો,
શાતિ ગૌરવ ગાથા રચવા, શું કરવું વિચાર કરો -- હો સુણો સુણો
સમાજના વણ-ઉકેલ્યા પ્રશ્નો, મનને મુંઝવણમાં મુકતા,
એ સવાલના જવાબ શોધવા, સાથ સૌ તૈયાર રહો -- હો સુણો સુણો
ભલેભલા ભાસાવી બંધુ, શુભ કાર્યોમાં ઝંપલાવો,
સમાજના ઉન્નત કાર્યોમાં, તન-મન-ધનથી સાથ દીયો - હો સુણો
કન્યાની કેળવણી ક્ષેત્રે, આંજ ભીસોણાં વરતાયે,
પુત્ર-પુત્રીના અભ્યાસ ક્ષેત્રે, ભેદભાવ આ શા માટે? (૨) - એ સવાલ
શિક્ષિત બહેનો ઘુંઘટ ઓઢે, નીજ પ્રતિભાને ગુંગળાવે,
આસાચાર આ રૂઢિચુસ્તતા, માન્ય કરાતી શા માટે? (૨) - એ સવાલ
છુટાછેડા સહેજે થઈ જાતા, ઘર ખુણે ને ઘર ભાંગે,
જે ગલઢેરા સ્વાર્થ પોષવા, હીણા કર્મ કરે શા માટે? (૨) - એ સવાલ
કન્યાનાં વેચાણ થતાં જેમ ગાય વેંચાય કસાઈ ઘરે,
દલાલનો એ ધીખતો ધંધો, હજુ સાંભળો શા માટે? (૨) - એ સવાલ
સંપ્રદાય એક સતપંથ ચાલે, હિન્દુ સંસ્કૃતિથી અલગ જણાયે,
સમાજનો એ ઠરાવ અઢારનું, ઉલ્લંઘન કરતા શા માટે? (૨) - એ સવાલ
આગેવાન સતપંથી કોં એવા, નીજ સ્વજનના મૃત્યુવેળા,
દફન ક્રિયા સિદ્ધાંતને ભૂલી, અગ્નિદાહ કરે શા માટે? (૨) - એ સવાલ
વિત્ત, સ્વાર્થી, કોઈ માનવા ભૂલ્યા, સમજે પણ સહુ સમજુ જનતા,
જાગ્યા ત્યાંથી સવાર ગણો, એ સૂત્ર વિસરતા શા માટે? (૨) - એ સવાલ
ધર્મ સનાતન પાટીદારનો, ઓધવરામજી સમજાવે,
ધર્મ વિઘ્નમાં લાગે તેવા, સંપ્રદાય એ શા માટે? (૨) - એ સવાલ
નારાયણ રામજી બહુ ઝઝુમ્યા, ધર્મ ભૂલી જ્ઞાતિ માટે
કંઈક વર્ષો વહી ગયાં પણ, આશા અધુરી શા માટે? (૨) - એ સવાલ
જટીલ પ્રશ્નોના ઉત્તર શોધવા, દોસ્તો મળજો એક સાથે,
નવચેતનીયાની દાઝ હૃદયની, ઉકેલવી ના શા માટે? (૨)
- એ સવાલનો જવાબ શોધવા ---

— — — — — — —

રચયિતા:
શ્રી અખેરામ વાલજી પટેલ
કલકત્તા.

realpatidar.com